



COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં જૂન 4 થી અમલી બનતા બ્રેમ્પટન ટ્રાન્ઝિટ સર્વિસમાં ફેરફારો

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જૂન 9, 2020) – સીટીના રિઓપનીંગ અને રિકવરી પ્લાનના ભાગરૂપે, સોમવાર, જૂન 15 થી, બસ સર્વિસમાં આગળ સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી નીચે મુજબના ફેરફારો થશે.

આપણી ટ્રાન્ઝિટ સિસ્ટમ લોકોને શહેરની આસપાસ કાર્યક્ષમ રીતે હેરફેર કરાવી શકતી હોવાની ખાતરી કરાવવા, જૂન 15 થી નીચેના બ્રેમ્પટન ટ્રાન્ઝિટ રૂટ્સ સંચાલનમાં રહેશે. અમારી પાસે ઉપલબ્ધ સંસાધનો વડે આ સર્વિસીસ ટકાવી રાખવા શ્રેષ્ઠ પ્રયત્નો કરવામાં આવશે.

- 501 ઝુમ ક્વીન
- 502 ઝુમ મેઈન
- 511/511A ઝુમ સ્ટીલ્સ
- 1/1A ક્વીન
- 2 મેઈન
- 3 મેક્લાફ્લિન
- 4/4A ચિંગકુસી
- 5/5A બોવાર્ડ
- 6 જેમ્સ પોટર
- 7/7A કેનેડી
- 8 સેન્ટર
- 9 વોડેન
- 10 સાઉથ ઈન્ડસ્ટ્રીયલ
- 11/11A સ્ટીલ્સ
- 14/14A ટોરબ્રામ
- 15 બ્રેમલી
- 18 ડિક્સી
- 20/20A ઈસ્ટ ઈન્ડસ્ટ્રીયલ
- 23 સેન્ડલવૂડ
- 26 માઉન્ટ પ્લેઝન્ટ
- 29 વિલિયમ્સ પાર્કવે
- 30 એરપોર્ટ રોડ
- 31 મેક્વીન
- 35 ક્લાર્કવે
- 50 ગોર રોડ
- 51 હીયરફોર્ડ
- 52 મેક્મર્ચી
- 53 રે લોસન
- 56 કિંગનોલ
- 57 ચારોલેઈસ
- 60 મિસિસાગા
- 115 પીયરસન એરપોર્ટ એક્સપ્રેસ



COVID-19 મહામારીને લીધે સીનિયર આઈડી અને વેટરન કાર્ડ્સ અત્યારે આપવામાં આવતા નથી. ગ્રાહકો આગળ સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી પોતાના એક્સ્પાયર્ડ કાર્ડ્સ વાપરવાનું ચાલુ રાખી શકે છે.

એક સ્મૃતિચિહ્ન તરીકે, ટર્મિનલ્સ પર ગ્રાહક સેવા કાઉન્ટર્સ બંધ કરવામાં આવ્યા છે. બ્રેમલી, બ્રેમ્પટન ગેટવે અને ડાઉનટાઉનમાં ટર્મિનલ બિલ્ડિંગમાં કામકાજના ક્લાકો સવારે 6 થી રાત્રે 9 વાગ્યા સુધી છે.

હાલમાં સર્વિસ ચાલુ હોય તેવા રૂટ્સ અને તેના સમયપત્રકોની યાદી માટે વેબસાઈટ જુઓ, www.bramptontransit.com.

COVID-19 સેફ્ટી મેઝર્સ (સુરક્ષા ઉપાયો)

વધારે સારી સફાઈ અને સ્વચ્છતા (સેનિટાઈઝિંગ) સમયપત્રક અમલમાં રહે છે. બ્રેમ્પટન ટ્રાન્ઝિટનું લક્ષ્ય તમામ સખત સપાટીઓ, ઓપરેટર કમ્પાર્ટમેન્ટ્સ અને બેઠકોને દર 48 કલાકે ચેપરહિત કરવાનું છે. મોટા ભાગની બસોને હાલમાં દર 24 કલાકે સેનિટાઈઝ કરવામાં આવે છે. સખત સપાટીઓ ધરાવતી સગવડો અને ટર્મિનલ્સને રોજંદા ધોરણે સાફ અને સેનિટાઈઝ કરવામાં આવે છે.

પીલ પબ્લિક હેલ્થ અને ગવર્નમેન્ટ ઓફ ઓન્ટેરિયોની પબ્લિક ટ્રાન્ઝિટમાં મારસ્ક્સ પહેરવાની ભલામણને અનુસરતા, બ્રેમ્પટન ટ્રાન્ઝિટમાં ઉતારુઓને અત્યારે બસો અને ટર્મિનલો પર નોન-મેડિકલ મારસ્ક્સ પહેરવાની કડક ભલામણ કરવામાં આવે છે. બ્રેમ્પટન ટ્રાન્ઝિટમાં ઉતારુઓ અને ઓપરેટરો માટે જુલાઈ 2 થી નોન-મેડિકલ મારસ્ક્સ પહેરવા અનિવાર્ય બનશે, જ્યારે ભાડું ચૂકવણી અને બસમાં આગળથી પ્રવેશ ફ્રી શરૂ કરવામાં આવશે. વધુ માહિતી માટે, [અહીં](#) ક્લિક કરો.

સીટી માર્ક પહેર્યો હોય તો પણ ઉતારુઓને ટર્મિનલ્સ અને બસ સ્ટોપ્સ પર વ્યક્તિઓ વચ્ચે ભૌતિક અંતર જાળવવાનું આચરણ ચાલુ રાખવાની વિનંતી કરે છે. સીટી ઉતારુઓને પોતાના અંગત ડિસઈન્ફેક્ટન્ટ (ચેપનાશક પદાર્થ), જેમ કે હેન્ડ સેનેટાઈઝર કે વાઈપ્સ સાથે રાખવાનું, પોતાના હાથ વારંવાર ધોવાનું અને પોતાની કોણીમાં ખાંસી કરવાનું કે છીંકવાનું પણ યાદ અપાવે છે.

સીટી ઓફ બ્રેમ્પટન COVID-19 મહામારી દરમિયાન જોખમો પર દેખરેખ ચાલુ રાખવા પીલ પબ્લિક હેલ્થ અને બ્રેમ્પટન ઈમરજન્સી મેનેજમેન્ટ ઓફિસમાં સાથે ધનિષ્ઠપણે કામ કરી રહ્યું છે. અઘતન માહિતી નિયમિત મેળવવા વેબસાઈટ

www.brampton.ca/covid19 અને www.bramptontransit.com જોતા રહો અથવા સર્વિસ અપડેટ્સ માટે Twitter પર @bramptontransit ને અનુસરો. કોઈ પ્રશ્નો સીધા બ્રેમ્પટન ટ્રાન્ઝિટના સંપર્ક કેન્દ્રને 905.874.2999 નંબર પર પૂછી શકાય છે.

-30-

મિડિયા સંપર્ક :

મોનિકા દુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca